



[Read in English](#)

આખા દિવસમાં તારી ભક્તિ માની...

આખા દિવસમાં તારી ભક્તિ માની... જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી...

આખા દિવસ.

મન કર્મ વચને રાજી તને, મારે કરવો છે એવું હતું મને... (૨)

મન ધાર્યું તોય કાંઈ થયું (હોય).... (૨) તો ક્ષમા કરજે પ્રભુ મને...

આખા દિવસ.

જાણે અજાણે વફાદારી તારી, ચૂકી દુઃખી થયા અમહિમામાં ભળી...(૨)

હઠ, માન, ઇર્ષ્યાથી કર્યા... (૨) હોય ઓશિયાળા તો દેજો માફી...(૨)

આખા દિવસ.

જાણપણાનો દરવાજો છોડી, સ્વામી ! અભાવ, વિક્ષેપના માર્ગે ચડી...(૨)

તને ભૂલી બીજું ચિંતવન થયું હોય... (૨) તો ક્ષમા માગું છું પાચે પડી...(૨)

આખા દિવસ.

અનુવૃત્તિ જાણી તને ગમશે કરી, જે કર્યું તેમાં ન હોય ભક્તિ તારી...(૨)

કરવાનું હોય તે ના કર્યું તો... (૨) ફરી સુઝાડો આ પ્રાણપતિ... (૨)

આખા દિવસ.

મોંઘામૂલી મૂર્તિ તેં સસ્તી કીધી, રૂડાં પ્રારબ્ધ માટે તેં સેવા દીધી (૨)

જાગૃત, સુષુપ્તિ, સ્વપ્નમાંહી....(૨) તારા થઈ રહીએ ઓ દયાનિધિ... (૨)

આખા દિવસ.





Ākhā divasamān tārī bhakti mānī...

Ākhā divasamān tārī bhakti mānī... Je karyun vichāryun te le svīkārī...

Ākhā divasa.

Man karma vachane rājī tane, māre karavo chhe evun hatun mane... (2)

Man dhāryun toya kānī thayun (hoya)... (2) to kṣhamā karaje prabhu mane...

Ākhā divasa.

Jāṇe ajāṇe vafādārī tārī, chūkī du:khī thayā amahimāmān bhaḷī...(2)

Haṭha, māna, irṣhyāthī karyā... (2) hoyā oshiyālā to deḷo māfī...(2)

Ākhā divasa.

Jāṇapaṇāno daravājo chhoḍī, swāmī ! Abhāva, vikṣhepanā māрге chaḍī...(2)

Tane bhūlī bījun chintavan thayun hoyā... (2) to kṣhamā māgun chhun pāye paḍī...(2)

Ākhā divasa.

Anuvṛutti jāṇī tane gamashe karī, je karyun temān n hoyā bhakti tārī...(2)

Karavānun hoyā te nā karyun to... (2) farī suzāḍo ā prāṇapati... (2)

Ākhā divasa.

Monghāmūlī mūrti ten sastī kīdhī, rūḍān prārabdha māṭe ten sevā dīdhī (2)

Jāgrata, suṣhupti, svapnamānhī....(2) tārā thāī rahīe o dayānidhi... (2)

Ākhā divasa.

